



NSL/CS/2024/41

Date: August 26, 2024

To,
The Department of Corporate Services
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai- 400 001

To,
The Listing Department
National Stock Exchange of India Limited
Exchange Plaza, C/1, Block G
Bandra-Kurla Complex, Bandra (E),
Mumbai - 400 051

Scrip Code: 542231

Scrip Symbol: NILASPACES

Dear Sir,

Reg: Submission of Newspaper Advertisement published for Notice of 24th Annual General Meeting, Book Closure, Remote E-voting and Other Information

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014 (as amended), we are hereby submitting copy of newspaper advertisement published in the Business Standard-English and Loksatta Jansatta - Gujarati edition regarding Remote E-Voting Information and Notice of 24th Annual General Meeting to be held through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM) facility on Monday, September 16, 2024.

Kindly take the same on your record and acknowledge the receipt.

Thanking you,
Yours faithfully,
For, Nila Spaces Limited

Gopi Dave
Company Secretary

Encl: a/a

NILA SPACES LIMITED
(CIN No: L45100GJ2000PLC083204)
Registered Office: 1st Floor, Sambhaav House, Opp. Chief Justice's Bunglow, Bodakdev, Ahmedabad - 380 015.
Phone: +91 79 4003 6817/ 18 Fax: +91-79-26873922
E-mail: secretarial@nilaspaces.com **Website:** www.nilaspaces.com

NOTICE OF 24th ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURE

NOTICE IS HEREBY GIVEN THAT THE 24th ANNUAL GENERAL MEETING ("AGM") OF THE COMPANY WILL BE HELD ON **MONDAY, 16 SEPTEMBER 2024 AT 11:30 A.M.** THROUGH VIDEO CONFERENCING (VC)/ OTHER AUDIO VISUAL MEANS (OAVM) TO TRANSACT THE BUSINESSES AS SET OUT IN THE NOTICE OF THE AGM.

Dispatch: Notice of the 24th AGM and Annual Report for the financial year ended on March 31, 2024 have been sent to all the Members whose email addresses are registered with the Company and/or Depositors in accordance with the Circular issued by Ministry of Corporate Affairs Circular No. 20/2020 dated May 05, 2020 read with its circulars No. 14/2020 dated April 08, 2020, Circular No. 17/2020 dated April 13, 2020, Circular No. 39/2020 dated December 31, 2020 and Circular No. 02/2021 dated January 13, 2021, Circular No. 02/2022 dated May 05, 2022, Circular No. 10/2022 dated December 28, 2022 and Circular No. 09/2023 dated September 25, 2023 (collectively referred to as "MCA Circulars") and SEBI Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 and circular no. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021, January 15, 2021, Circular No. SEBI/HO/DDHS/P/CIR/2022/0063 dated May 13, 2022 and Circular No. SEBI/HO/CFD/CFD-Pod-2/P/CIR/2023/167 dated October 07, 2023 (collectively referred to as "SEBI Circulars"). The dispatch of Notice of AGM has been completed on **Saturday, 24 August 2024**.

The Notice of the 24th AGM and Annual Report for the financial year ended on March 31, 2024 inter-alia indicating the process and manner of remote e-voting are available at the Company's website at www.nilaspaces.com under investors segment which can be freely downloaded by any member.

Book Closure: Notice is also hereby given that pursuant to provision of Section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from **10 September 2024 to 16 September 2024** (both days inclusive) for the purpose of 24th AGM of the Company.

Voting through Electronic Mode: Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, Secretarial Standards - 2 on General Meetings and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Members of the Company holding shares either in physical or dematerialized form as on the cut-off date i.e. **09 September 2024** are offered the facility of exercising their votes by electronic means through the remote e-voting services provided by National Securities Depository Limited ("NSDL") on any or all businesses to be transacted at the AGM as specified in the notice.

The remote e-voting shall commence on **Friday, 13 September 2024, (09:00 a.m.)** and shall end on **Sunday, 15 September 2024, (05:00 p.m.)**. The remote e-voting shall be disabled by NSDL after the said date and time. Once the votes are casted by the Members on the various resolutions by remote e-voting, he/she will not be allowed to change it subsequently. Those members, who shall be present at the AGM through VC/OAVM facility and had not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.

Any person who acquires shares of the Company and becomes a Member after dispatch of the Notice and holding shares as on cut-off date i.e. **09 September 2024**, may obtain the login ID and Password by sending a request at evoting@nsdl.com or to the Company at secretarial@nilaspaces.com or to the Company's Registrar, M/s. MCS Share Transfer Agent Limited at mcstaahmd@gmail.com. However, if a person is already registered with NSDL for remote e-voting then existing user ID and Password can be used for casting vote.

The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/ participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their votes again.

Scrutinizer: The Company has appointed Mr. Umesh Ved of M/s Umesh Ved & Associates, Practicing Company Secretary as the Scrutinizer to scrutinize the remote e-voting and e-voting process during the AGM in a fair and transparent manner.

Contact Details: In case of any queries relating to e-voting process, members may refer Frequently Asked Questions (FAQs) and e-voting user manual for members available under the Help Section of www.evoting.nsdl.com. In case of any grievances connected with the facility for voting by electronic means may be addressed to Ms. Pallavi Matre Sr. Manager, National Securities Depository Limited ("NSDL"), TradeWorld, A/Wing, 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, MUMBAI - 400 013, or send an email to evoting@nsdl.com or call on 022-24994545 or contact M/s. MCS Share Transfer Agent Limited at mcstaahmd@gmail.com, Tel: 079-26580461/62/63.

Voting Results: The Voting Results on the resolution passed shall be declared within forty-eight hours of the conclusion of the AGM.

Date: 24 August 2024
Place: Ahmedabad

For, Nil Spaces Limited
By Order of Board of Directors
Gopi Dave-Company Secretary

Companies, Insight Out

RELIANCE Corporate Office: 11th Floor, North Side, R-Tech Park, Western Express Highway, Goregaon (East), Mumbai-400063. **PUBLIC NOTICE FOR E-AUCTION SALE OF SECURED ASSETS**

Reliance Asset Reconstruction Company Ltd. (RARC), a Trustee of "RARC DENA BANK 024 TRUST" is an Assignee and a Secured Creditor of below mentioned Borrowers by virtue of Assignment Agreement dated 09.12.2016 executed with The Dena Bank. The undersigned in exercise of powers conferred under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and Security Interest (Enforcement) Rules, 2002 hereby give notice to public in general that the below mentioned properties shall be sold by way of "online e-auction" for recovery of dues. The properties shall be sold strictly on "AS IS WHERE IS", "AS IS WHAT IS" and "NO RECOURSE" basis apart from other terms mentioned below.

Name of Borrower/Guarantors	Outstanding dues
1. M/s Shrinathji Cotex Pvt. Ltd. Survey No. 364/P Opp. Shreeram gining, Pithadia National Highway, At: Pithadia, Tal: Jelpur, Dist: Rajkot - 360370.	Rs. 59,04,13,933/- (Rupees Fifty Nine Crores Four Lakh Thirteen Thousand Nine Hundred Thirty Three Only) outstanding for loan accounts (57413023849, 57454023794, 57454023795, 57457023764 and 57457023765) as on 16th Aug 2024 with future interest thereon till the date of entire payment.
2. Mr. Dineshbhai B. Bambhaniya 1st Floor, Credit Corner, 20/25, New Jagannath Plot, Rajkot - 360001 Also At: Kamlapur, Tal: Jasdan, Dist: Rajkot - 360025	Rs. 70,00,000/- (Rupees Seventy Lakh Only)
3. Smt. Muktaben Manubhai (Mansukhbhai) Savaliya 5, Sorathiyawadi, Rajkot - 360002 Also At: Plot No. 9, Survey No. 294/7 in City Ward No. 11, Sorthiyawadi Circle, 80 feet Road, Rajkot - 360002	Rs. 7,00,000/- (Rupees Seven Lakh Only)
4. Mr. Mansukhbhai Tapubhai Savaliya 5, Sorathiyawadi Rajkot - 360002 Also At: Plot No. 27/A-2, Survey No. 262(Part), Ward No. 11, Mehul Nagar, Street No. 6, Behind Nilkanth Talkies, Off. Kothariya Road, Rajkot - 36002	
5. Mr. Yogeshkumar Babubhai Bambhaniya At: Kamlapur, Tal: Jasdan, Dist: Rajkot - 360025	
6. Mr. Rajesh Amarishbhai Patel (Umrjetiya) At: Kamlapur, Tal: Jasdan, Dist: Rajkot - 360025	

DESCRIPTION OF THE IMMOVABLES/PROPERTY	Reserve Price	Emd Amount
Property Lot-1- Residential Premises owned by Mr. Muktaben M Savaliya A Piece and parcel of land of plot No.9 paliki admeasuring Sq.Yards 120.00 Sq.Mts.99.78 with superstructure thereon/ N.A. land revenue survey No.294/7 part of Rajkot bearing City Survey No.1348, City Survey No.1348, City Survey Sheet No.273, Ward No.11, situated at Sorathiyawadi, Street No.5, Kothariya Road, Rajkot. The said property known as "Bakul" which is bounded as under Boundaries- North: - Road, it admeasures 20.0 Fts. South: - Others property, it admeasures 20.0 Fts. East: - Others property of this plot, it admeasures 54.0 Fts. West: - Property of plot No: 10, it admeasures 54.0 Fts.	Rs.70,00,000/- (Rupees Seventy Lakh Only)	Rs.7,00,000/- (Rupees Seven Lakh Only)
Property Lot-2- Residential premises constructed on Sub plot no. 27/A-2, R S No. 262 part, F P No. 89+90 part, O P No. 24, T P S No. 6 C S ward no. 11, Mehul Nagar street no. 6 Behind Nilkanth Talkies, Off Kothariya road, Rajkot, Gujarat. Owner Name: Mansukhbhai Tapubhai Savaliya Boundaries EAST : Property of Sub-Plot No.5 (27/C). WEST : Road. NORTH : Property of Sub-Plot No.1 (27/A-1). SOUTH : Property of Sub-Plot No.3 (27/B-1).		

Properties are in possession under with Reliance ARC

Details of Auction Events: -
Inspection of Property : 03.09.2024 from 03.00 P.M. to 05.00 P.M.
Last date for bid submission : 10.09.2024
Date of e-auction : 11.09.2024 between 12:00 P.M. to 1:00 P.M. (with extension of 5 minutes each)

TERMS AND CONDITIONS OF E-AUCTION SALE

- The property shall not be sold below the reserve price and sale is subject to the confirmation by RARC as secured creditor. The properties shall be sold strictly on "AS IS WHERE IS" and "AS IS WHAT IS BASIS."
- E-auction will be held through RARC's approved service provider M/s ARCA EMART PRIVATE LIMITED at website: <https://www.auctionbazaar.com> (web portal of ARCA EMART PRIVATE LIMITED). E-auction tender documents containing online e-auction bid form along with General Terms and Conditions of online e-auction sale are available in websites: www.rarc.com and <https://www.auctionbazaar.com> intending bidders may download relevant documents.
- The intending bidders are required to have a valid email id as the participation ID and password by e-auction agency shall be communicated at their e-mail id only.
- Bidder has to mandatorily give undertaking under Section 29A of Indian Bankruptcy Code, 2016.
- Intending bidders have to submit their BID in the prescribed format with EMD remittance details along with self-attested KYC documents (PAN, AADHAR card etc.) and the same shall be submitted to Authorized Officer of Reliance Asset Reconstruction Company Limited (RARC) at 11th floor, North Side, R Tech Park, Off WE Highway Goregaon (East), Mumbai-400063 and by email to jayesh.more@reliancearc.com and vinod.pawaskar@reliancearc.com, after which the participation ID and password shall be communicated at their email only. Last date of submission of Bid Form is on 10.09.2024. The bid form or EMD received late for any reason whatsoever will not be entertained. Bid without EMD and Bid below the reserve price shall be rejected summarily.
- Neither RARC nor the service provider will be responsible for any lapses/failure on the part of the bidder on account of network disruptions. Toward of such incidents, bidders are advised to make all necessary arrangements such as alternative power back-ups etc.
- Earnest Money Deposit (EMD) shall be deposited through RTGS/NEFT fund transfer to Current Account No 9962020000694, Name of the Bank: Bank of Baroda, Branch: Santacruz (East), Mumbai, Name of the Beneficiary: RARC DENA BANK 024 TRUST, IFSC Code: BARB0DBSCRU. Please note that the Cheques/Demand Draft shall not be accepted towards EMD.
- The Bids below reserve price and/or without EMD amount shall not be accepted. Bidders must improve their further bid amount in multiple of Rs.1,00,000/- each (Rupees One Lakhs Only). In case sole bidder, bidder has to improve his bid minimum by one incremental.
- The successful bidder shall pay 25% of the bid amount/sale price (including earnest money already paid) immediately after declaration of successful bidder. The successful bidder shall deposit balance 75% of the bid amount/sale price within 15 days from declaration of successful bidder.
- If successful bidder fails to deposit sale price as stated above, all deposits including EMD shall be deemed to be forfeited without any further notice. However, extension of further reasonable period for making payment of balance 75% may be allowed and shall be at the sole discretion of authorized officer.
- The EMD amount of unsuccessful bidders will be returned without interest, after the closure of the E-auction sale proceedings.
- The particulars given by the Authorized officer are stated to the best of his knowledge, belief and records. Authorized officer shall not be responsible for any error, mis-statement or omission etc.
- The undersigned Authorized Officer has the absolute right and discretion to accept or reject any bid or adjourn/postpone/cancel the sale or modify any terms and conditions of the sale without any prior notice or assigning any reasons.
- The bidders should make discreet enquiries as regards charges/encumbrances on the property and should satisfy themselves about the title, extent, quality of the property before submitting their bid. No claim of whatsoever nature regarding charges, encumbrances over the property and any other matter etc., shall be entertained after submission of the online bid.
- Any arrears, dues, taxes, charges whether statutory or otherwise including stamp duty/registration fees and applicable TDS on sale of property shall be borne by the purchaser only.
- For further details, contact Mr. Jayesh More, Associate Vice President -Resolution, Mobile No- 8422905545 or Mr. Vinod Pawaskar, Head-Legal, Mobile No-8080722836 and Mr. Akshaay Rao, Senior Vice President-Legal, Mobile No.9136763354, Reliance Asset Reconstruction Company Ltd. at above mentioned address.
- The sale certificate shall be issued after receipt of entire sale consideration and confirmation of sale by secured creditor. The sale certificate shall be issued in the name of the successful bidder. No request for change of name in the sale certificate other than the person who submitted the bid/participated in the e-auction will be entertained.

THIS NOTICE WILL ALSO SERVE AS STATUTORY 15 DAYS' NOTICE TO THE BORROWER/GUARANTORS/MORTGAGOR UNDER SARFAESI ACT AND RULES MADE THEREUNDER.

Place: RAJKOT
Date: 26.08.2024

Authorized Officer
For Reliance Asset Reconstruction Co. Ltd.,

Companies,
Monday to Saturday

To book your copy,
sms reachbs
to 57575 or
email order@bmail.in

Business Standard
Years of Insight

NAGA Limited
Regd. Office: No.1, Anna Pillai Street, Chennai - 600 001 Phone: 044 - 2536 3535
CIN : U10611TN1991PLC020409, Website : www.nagamills.com, E-mail: cs@nagamills.com

EXTRACT OF UNAUDITED STANDALONE & CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2024

S. No.	Particulars	Standalone				Consolidated			
		Quarter Ended		Year Ended		Quarter Ended		Year Ended	
		30.06.2024 (Unaudited)	31.03.2024 (Audited)	30.06.2023 (Unaudited)	31.03.2024 (Audited)	30.06.2024 (Unaudited)	31.03.2024 (Audited)	30.06.2023 (Unaudited)	31.03.2024 (Audited)
1	Total Income from Operations	543.07	508.97	519.11	2,057.68	543.08	509.14	519.11	2,057.87
2	Profit before Interest, Depreciation & Taxes (EBITDA)	26.00	38.53	21.89	119.22	26.01	38.49	21.89	119.33
3	Net Profit / (Loss) from ordinary activities, (before Tax and Exceptional Items)	1.11	16.02	1.90	31.23	1.12	16.00	1.90	31.34
4	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional Items)	1.11	16.02	1.90	31.23	1.12	16.00	1.90	31.34
5	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional Items)	0.76	14.00	1.35	26.74	0.77	13.97	1.35	26.85
6	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income, (after Tax)	0.76	13.69	1.35	26.43	0.77	13.66	1.35	26.54
7	Equity Share Capital	14.25	14.25	14.25	14.25	14.25	14.25	14.25	14.25
8	Earnings Per Share (of Rs. 10 each)								
	(a) Basic EPS Rs.	0.53	9.82	0.95	18.77	0.54	9.81	0.95	18.94
	(b) Diluted EPS Rs.	0.52	9.63	0.95	18.38	0.53	9.61	0.95	18.47

Notes:
1. The above unaudited financial results of the Company for the quarter ended June 30, 2024 were reviewed and recommended by Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on August 23, 2024, which has been subjected to limited review by Statutory Auditors.
2. The full format of Quarterly and Year ended Financial Results is available on the Company's website www.nagamills.com.

For and on behalf of the Board
Sd/-
K.S. KAMALAKANNAN
Chairman and Managing Director
(DIN 01601589)

Place : Chennai
Date : August 23, 2024

HDFC BANK **HDFC Bank Ltd.** **DEMAND NOTICE**
Branch: HDFC House, Near Mithalkhail Six Roads, Navrangpura Ahmedabad-380009. Ph: (079) 66307000

Under Section 13 (2) of the Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002.

Whereas the undersigned being the Authorised Officer of HDFC Bank Limited (erstwhile HDFC Limited having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023) (HDFC) under Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (2) of the Security Interest (Enforcement) Rules, 2002, issued Demand Notices under Section 13 (2) of the said Act, calling upon the Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) listed hereunder, to pay the amounts mentioned in the respective Demand Notice/s, within 60 days from the date of the respective Notice/s, as per details given below. The undersigned have, caused these Notices to be pasted on the premises of the last known respective addresses of the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s). Copies of the said Notices are available with the undersigned, and the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s), may, if they so desire, collect the respective copy from the undersigned on any working day during normal office hours.

In connection with the above, Notice is hereby given, once again, to the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) to pay to HDFC, within 60 days from the date of publication of this Notice, the amounts indicated herein below in their respective names, together with further interest as applicable according to the detailed mentioned in the said Demand Notices from the respective dates mentioned below in column (c) till the date of payment and / or realisation, read with the loan agreement and other documents/writings, if any, executed by the said Borrower(s). As security for due repayment of the loan, the following Secured Asset(s) have been mortgaged to HDFC by the said Borrower(s) respectively.

Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) attention is invited to the provisions of sub-section (B) of section 13 of the Act, in respect of time available to redeem the secured asset/s.

Sr. No	Name of Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s)	Total Outstanding Dues	Date of Demand Notice	Description of Secured Asset(s) / Immovable Property (ies)
(a)	(b)	(c)	(d)	(e)
1	MR. BHARAT VELJIBHAI SOLANKI (BORROWER) MRS. SONALBEN VELJI SOLANKI (CO-BORROWER)	Rs.25,24,228/- and Rs.15,07,597/- respectively as on 31 July, 2024*	21 Aug., 2024	HOUSE 396, COLONY SECTOR - 5, SATHWARA COLONY, GANDHIDHAM S.O, GANDHIDHAM - 370201.
2	MR. ANIL TUKARAM JADHAV (BORROWER)	Rs.7,79,892/- as on 31 July, 2024*	21 Aug., 2024	FLAT NO. B-1-301, 3RD FLOOR, MADHUVAN GLORY, BLOCK - B, PLOT FP-71, S. NO. 954, TP - 2, SHREENATH (NARODA) CHSL, NR. SHREE RAM CHOWK, NEXT TO DHARNIDHAR AVE., KRISHNANAGAR, NARODA, AHMEDABAD - 382330.
3	MR. DINESH KUMAR GAUTAM (BORROWER) MRS. SUJATA RANI (CO-BORROWER)	Rs.40,80,104/- as on 30 June, 2024*	13 Aug., 2024	UNIT - 408, 4TH FLOOR, NARAYAN ARCADE, PLOT FP NO. 52/1, S. NO. 237/1, TP-62, NR. SHAHWADI BUS STAND, N.H. 8, NAROL, AHMEDABAD - 382405.
4	MR. VIPUL RAMESHBHAI MAKWANA (BORROWER)	Rs.11,56,076/-, Rs.31,905/-, Rs.2,45,860/- and Rs.6,859/- respectively as on 30 June, 2024*	13 Aug., 2024	FLAT - E/704, 7TH FLOOR, PANCHSHLOK RESI., BLOCK - E, PLOT FP - 18, UNIT DTPS - 69, S. NO. 251, 251/P, B/H SATYAMEV HOSPITAL, NEW CHANDKHEDA, CHANDKHEDA, GANDHINAGAR - 382424.
5	MR. SHIVNATH MANDAL (BORROWER) MRS. POONAM MANDAL (CO-BORROWER)	Rs.44,15,105/- as on 30 June, 2024*	13 Aug., 2024	FLAT - D/601, 6TH FLOOR, SAMPAD ALBERO, BLOCK - D, PLOT FP - 44/1, S. NO. 54/1, TPS - 46, B/H MC DONALD, NR. MANILAL PARTY PLOT, MOTERA, ZUNDAL, AHMEDABAD - 380005.
6	MR. ABHISHEK PANCHAL (BORROWER) MRS. JAYSHREEBEN PANCHAL (CO-BORROWER)	Rs.56,644/- and Rs.15,88,476/- respectively as on 30 June, 2024*	13 Aug., 2024	UNIT - D/304, 3RD FLOOR, ARVIND MEGA TRADE, R.S. 423/1, 423/2, TPS - 12, FP - 16, ARVIND MILLS ROAD, NARODA, AHMEDABAD - 382330.
7	MR. KHODABHAI PATEL (BORROWER) MRS. KOMALBEN KHODABHAI PATEL (CO-BORROWER)	Rs.15,02,436/- and Rs.1,00,177/- respectively as on 30 June, 2024*	13 Aug., 2024	FLAT - C/303, 3RD FLOOR, SAVVY STRATA, TOWER - C, PLOT FP - 65/1, S. NO. 79/1, TPS - 86, F/1, L. J. COMMERCE COLLEGE ROAD, NR. YMCA CLUB, OFF - S. G. HIGHWAY, AHMEDABAD - 380001.
8	MR. JAGATSIKH UMEDESIKH RAJPUT (BORROWER) MRS. LEENA JAGATSIKH RAJPUT (CO-BORROWER)	Rs.11,76,408/- as on 30 June, 2024*	13 Aug., 2024	FLAT NO. - A/504, 5TH FLOOR, SAKAL - 59, BLOCK NO. 680, 681/2, B/H CHANDKHEDA BUS STOP, OFF - SABARMATI HIGHWAY, CHANDKHEDA, SABARMATI, AHMEDABAD - 380005.
9	MR. MILAN MAHADEV SANGHAVI (BORROWER) MRS. NEHAIBEN MILANBHAI SANGHAVI (CO-BORROWER)	Rs.15,90,457/- and Rs.1,26,931/- respectively as on 30 June, 2024*	13 Aug., 2024	FLAT - E-3/108, 1ST FLOOR, LAKE VIEW RESIDENCY - E-3 (E. T. S. NO. 348/1/P-1), OPP. GURUDWARA, OPP. ST. MARY'S SCHOOL, SILVASSA - VAPI MAIN ROAD, DUNGRA, VAPI - 396195.
10	MR. SUNILKUMAR SURYNARAYAN TIWARI (BORROWER)	Rs.9,41,715/- as on 30 June, 2024*	13 Aug., 2024	FLAT - G/406, 4TH FLOOR, ATRI RESIDENCY, BLOCK - G, PLOT - 44, S. NO. 247, TPS - 112, NR. SHREEYA RESIDENCY, ODHAV RING ROAD TO VASTRAL CIRCLE, S. P. RING ROAD, ODHAV, AHMEDABAD - 382415.

*with further interest as applicable, incidental expenses, costs, charges etc incurred till the date of payment and / or realization.
If the said Borrowers shall fail to make payment to HDFC as aforesaid, then HDFC shall proceed against the above Secured Asset(s) / Immovable Property (ies) under Section 13 (4) of the said Act and the applicable Rules entirely at the risk of the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) as to the costs and consequences.
The said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) are prohibited under the said Act to transfer the aforesaid Secured Asset(s) / Immovable Property (ies), whether by way of sale, lease or otherwise without the prior written consent of HDFC. Any person who contravenes or abets contravention of the provisions of the Act or Rules made thereunder shall be liable for imprisonment and/or penalty as provided under the Act.

Date: 24-08-2024
Place: Ahmedabad

For, HDFC Bank Limited
Sd/-
Authorised Officer

Regd. Office: HDFC Bank House, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai- 400020
CIN L65920MH1994PLC080618 Website: www.hdfcbank.com

